



HCR-001-001570

Seat No. _____

B. A. (Sem. V) (CBCS) Examination

October - 2017

Sociology : Paper - XVI

(Population & Society) (New Course)

Faculty Code : 001

Subject Code : 001570

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : (૧) બધા પ્રશ્નોના ઉત્તર લખો.
(૨) બધા પ્રશ્નોના ગુણ સરખા છે.

- | | | |
|---|---|----|
| ૧ | સ્થળાંતરનો અર્થ આપી, તેના પ્રકારો સમજાવો. | ૧૪ |
| | અથવા | |
| ૧ | મૃત્યુદરનો અર્થ આપી, ભારતમાં મૃત્યુદરનાં કારણો સમજાવો. | ૧૪ |
| ૨ | જન્મદરનો અર્થ આપી, ભારતમાં ઊંચા જન્મદરનાં કારણો સમજાવો. | ૧૪ |
| | અથવા | |
| ૨ | વસ્તી સંક્રાંતિનો સિદ્ધાંત સમજાવો. | ૧૪ |
| ૩ | માલ્થસનો વસ્તી સિદ્ધાંત સમજાવો. | ૧૪ |
| | અથવા | |
| ૩ | વય અને લિંગ રચના વર્ણવી, તેની સામાજિક અસરો સમજાવો. | ૧૪ |
| ૪ | ભારતમાં વસ્તી અભ્યાસ માટેની આવશ્યકતા સમજાવો. | ૧૪ |
| | અથવા | |
| ૪ | વસ્તીવૃદ્ધિની સામાજિક વિકાસ ઉપર થતી અસરો સમજાવો. | ૧૪ |
| ૫ | નીચેના પ્રશ્નોના જવાબ આપો : (કોઈ પણ બે) | ૧૪ |
| | (૧) સ્થળાંતરનાં કારણો સમજાવો | |
| | (૨) બાળમૃત્યુ સમજાવો | |
| | (૩) વસ્તી અને સમાજ વચ્ચેનો સંબંધ સમજાવો | |
| | (૪) ઈસ્ટવસ્તીનો સિદ્ધાંત સમજાવો. | |

ENGLISH VERSION

- Instructions :** (1) Write answers of all questions.
(2) All questions carry equal marks.

1 Give the meaning of migration. Explain its types. 14

OR

1 Give the meaning of death rate. Explain the causes of death rate in India. 14

2 Give the meaning of birth rate. Explain the causes of high birth rate in India. 14

OR

2 Explain the theory of demographic transition. 14

3 Explain the Malthus's theory of population. 14

OR

3 Discuss the age and sex structure. Explain its social effects. 14

4 Explain the need for population study in India. 14

OR

4 Explain the effects of population growth on social development. 14

5 Give the answers of following questions : (any two) 14

- (1) Explain the causes of migration
- (2) Explain the child death
- (3) Explain the relation between population and society
- (4) Explain the theory of optimum population.
